

ત્વરિત જાહેરાત માટે

સાઈટ સિલેક્શન મેગેઝિન દ્વારા સિટી ઓફ બ્રમ્પટનને રોકાણ માટે શ્રેષ્ઠ શહેર તરીકે નવાજવામાં આવ્યું

બ્રમ્પટન, ઓન્ટારિયો (03 સપ્ટેમ્બર 2021) – ગઈ કાલે સાઈટ સિલેક્શન મેગેઝિન જે એક આંતરરાષ્ટ્રીય સ્તરે મળી આવતું વ્યાપાર પ્રકાશન છે જે કોર્પોરેટ રિઅલ એસ્ટેટ અને આર્થિક વિકાસ વિષે લખે છે તેમણે તેમના કેનેડાના શ્રેષ્ઠ સ્થળોની યાદી બહાર પાડી હતી જેમાં સિટી ઓફ બ્રમ્પટનને પ્રથમ 20 શહેરોમાંથી એક હોવાનું લેખાવ્યું હતું.

આરેકિંગ સાથે સિટીની [આર્થિક વિકાસ ક્યેરી](#) ને સાઈટ સિલેક્શન મેગેઝિને કેનેડાના રોકાણ માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે નવાજ્યું. સિટીના અતિમહત્વના સેક્ટરોને આર્થિક રીતે વિકસાવવાના પ્રયાસો પર સિટી ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલું રાખે છે.: ઈનોવેશન અને ટેકનોલોજી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ફૂડ એન્ડ બેવરેજ પ્રોસેસિંગ અને આરોગ્ય તથા લાઈફ સાયન્સિસ 2020માં બિઝનેસ રિટેશન અને વિસ્તરણ પર સિટીની FDI વ્યુહરચનાના ભાગરૂપે વધુ ભાર આપવામાં આવ્યો હતો. બ્રમ્પટન કેનેડાનું બીજું સૌથી ઝડપથી વિકાસ પામતું શહેર છે જ્યાની વસ્તી 7,00,000ની આસપાસ છે. સરેરાશ ઉંમર 36 સાથે બ્રમ્પટનના યુવાન, શિક્ષિત અને વૈવિધ્યસભર 3,20,000 જેટલો કામદાર સમૂહ 234 સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ 115 ભાષાઓ બોલે છે.

શહેરની [આર્થિક રિકવરી વ્યુહરચનાનો મહત્વપૂર્ણ સ્તંભ](#) છે જેને બ્રમ્પટન સીટી કાઉન્સિલ દ્વારા મે 2020માં મંજૂરી આપવામાં આવી હતી. સિટીના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટનું ચાલુ રહેલ વિકાસ આ વ્યુહરચનાનો બીજો અગત્યનો મુદ્દો છે. આર્થિક રિકવરીની વ્યુહરચનાનું લક્ષ્ય બ્રમ્પટનના અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા અને સ્પર્ધાત્મક લાભ ઊભો કરવાનું છે અને તેનાથી સિટીને COVID-19 મહામારીમાં આગળ વધવામાં મદદરૂપ થશે.

બ્રમ્પટન શહેરમાં નોંધપાત્ર રોકાણ આકર્ષી રહ્યું છે. નીચે એવી હોડી પરિયોજનાઓ આપી છે જેની જાહેરાત તાજેતરમાં થઈ:

- **અલેક્ટ્રા (Alectra):** જુનમાં [અલેક્ટ્રાએ જાહેર ક્યુ](#)તેમની 200 કેનેડી રોડ સાઉથ ખાતે બ્રમ્પટનમાં નવા નક્કોર ઓપરેશન્સ સેંટરનું બાંધકામ કરવાની યોજના.
નવા સ્થળના એક કિલોમીટરની અંદર રિટેઈલ સેક્ટરના 78 વ્યવસાયો છે અને આવાસ તેમજ ફૂડ સર્વિસિસના 55 વ્યવસાયો આવેલા છે. આ વિસ્તારમાં 400 કર્મચારીઓ લાવીને - જે હાલના સ્થળે જેટલો રોજગાર છે તેના અઢી ઘણા વધુ છે - અલેક્ટ્રા બ્રમ્પટનના ઓપરેશન્સ સેંટરની પાસેના અંતરે રિટેઈલ અને ફૂડના વ્યવસાયોને બળ આપશે, જેથી શહેરની સ્થાનિક અર્થવ્યવસ્થાને જગાડવાનું કામ થશે અને ભવિષ્યમાં વિકાસનો પંથ પકડાશે.
- **કોક કેનેડા બોટલિંગ:** ડિસેમ્બર 2020માં કોક કેનેડા બોટલિંગ દ્વારા \$12.8 મિલિયનનું નવું નિવેશ કોક કેનેડા બોટલિંગની ફેસિલિટીમાં કરવાનું જાહેર કરાયું. આ રોકાણનો ઉપયોગ પ્રવર્તમાન લાઈન ઉત્પાદન ક્ષમતાઓને ઉપભોક્તાઓ માટે ઉત્પાદના વધુ ઈનોવેશનની જરૂરિયાતને પૂર્ણ કરશે.
- **મેપલ લોજ ફાર્મ્સ:** આ વર્ષના પૂર્વાધમાં મેપલ લોજ ફાર્મ્સ દ્વારા જાહેરાત કરવામાં આવી કે તેઓ તેમના બ્રમ્પટનના કારખાનાનું 2,50,000 સ્કવેર ફીટ જેટલું વિસ્તરણ કરવાની યોજના બનાવે છે જેનાથી વધારાના 300 રોજગાર ઊભા થશે. તેમની એવી યોજના પણ છે કે ચીકન શોપ રિટેઈલ લોકેશનનું નવું સ્થળ ઊભું કરવું જેથી 100 જેટલા નવા રોજગાર સર્જાશે.

સંપૂર્ણ પરિણામો અને ક્રમાંકન વિશે વધુ માહિતી [અહીં](#) ઉપલબ્ધ છે.

સુવાક્યો

"બ્રેમ્પટન તકોનું શહેર છે અને આપણે કેનેડાના ઈનોવેશન કોરિડોરમાં પ્રાથમ લોકેશન ધરાવતા હોવાને કારણે તેમજ આપણી સ્પર્ધાત્મક પ્રતિભાઓના સમૂહને કારણે આપણે રોકાણ માટે વૈશ્વિક વ્યવસાયોને એક શ્રેષ્ઠ સ્થાન પૂરું પાડી શકીએ છીએ. અમને ગર્વ છે કે આપણે કેનેડાના શ્રેષ્ઠ લોકેશન તરીકે સાઈટ સિલેક્શન મેગેઝિન દ્વારા ચીંધાયા અને એવા તમામ સંભવિત સાઈટ પસંદગી કર્તાઓનું સ્વાગત કરીએ છીએ જેથી તેઓ જાણી શકે કે આપણે ભવિષ્યના વૈશ્વિક સ્તરનું શહેર કેવી રીતે બની શક્યા."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"મહામારીની અસરોને પાછળ મુકીએ તો રોકાણ હવે સ્પર્ધાત્મક લાભ મેળવવા માટે મહત્વની ભૂમિકા ભજવશે જેથી આપણે જ્યારે ફરી જાગી ઉઠવાના સ્વપ્ન સેવીએ છીએ ત્યારે બ્રેમ્પટનને સ્પર્ધાત્મક લાભ સ્થિતિસ્થાપકતા લાવી આપશે. બ્રેમ્પટન આ બાબતે ગંભીર છે અને અમને ગર્વ છે કે સાઈટ સિલેક્શન મેગેઝિને આપણા શહેરને રોકાણ માટેના કેનેડાના શ્રેષ્ઠ સ્થાન તરીકે નવાજ્યું."

- માર્ટિન મેડિરોસ (Martin Medeiros), રીજનલ કાઉન્સિલર, વોર્ડ 3 & 4; પ્રમુખ, ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર: સીટી ઓફ બ્રેમ્પટન.

"રોકાણ શહેરની આર્થિક રિકવરી વ્યુહરચનાની મહત્વપૂર્ણ આધારશીલા છે અને બ્રેમ્પટન પોતાને એક ઈનોવેટિવ શહેર તરીકે સ્થાપવા માટે સમર્પિત છે જે કેનેડા તેમજ વિશ્વ માટે વ્યાપારનું પ્રાથમ લોકેશન બનીને ઉભરી આવે. અમે સાઈટ સિલેક્શન દ્વારા આપણા વિશ્વ સ્તરના શહેરને કેનેડાના શ્રેષ્ઠ લોકેશન તરીકે નવાજવામાં આવ્યું તેનું સ્વાગત કરીએ છીએ. આપણા કૌશલ્ય ધરાવતા પ્રતિભાના સમુહ સાથે તેમજ ઈનોવેશન કોરિડોર પર સ્થિત હોવાથી અને સમર્પિત આર્થિક વિકાસની ટીમ ધરાવતા હોવાથી બ્રેમ્પટન આપણા સમાજમાં રોકાણોનું સ્વાગત કરવા તૈયાર છે."

- પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 & 5; ઉપ પ્રમુખ, ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર: સીટી ઓફ બ્રેમ્પટન.

"સિટી ઓફ બ્રેમ્પટન ખાતે અ ટર્મ ઓફ કાઉન્સિલ પ્રાયોરિટીને ટેકો આપવા સમર્પિત છીએ: બ્રેમ્પટન તકોનું શહેર છે અને અમે પોતાને વ્યવસાયો રોકાણ કરે તે માટે આદર્શ લોકેશન સાબિત કરવાનું ચાલુ રાખ્યું છે. બ્રેમ્પટનના આર્થિક વિકાસની કચેરીમાં રહેલ આપણી ટીમને અભિનંદન કે આપણે કેનેડાના શ્રેષ્ઠ લોકેશન તરીકે ઓળખ પામ્યા. આપણે જ્યારે COVID-19ની મહામારીમાંથી આગળ વધી રહ્યા છીએ ત્યારે અમારું ધ્યાન આપણું શહેર કેવી રીતે ફરી બેઠું થાય તેના પર કેન્દ્રિત છે અને અમે ચાલુ રહેલ રોકાણને સ્થાપીને આપણા અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા લાવવાનું ચાલુ રાખીશું."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूडान्मक संवाढ

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca